Shri Jagdamba Polymers Limited

Regd. Office: "HARMONY", 4th Floor, 15/A, Shree Vidhyanagar Co-Op. Hsg. Soc. Ltd., Opp. NABARD, Nr. Usmanpura Garden, Usmanpura, Ahmedabad - 380014 (INDIA)
Tele. No. +91-79-26565792, E-mail ID - admin@jagdambapolymers.com & gst@jagdambapolymers.com CIN - L17239GJ1985PLC007829 & GST No.- 24AACCS1262K1ZH



Date: 10th November, 2023

To,
The Secretary,
Department of Corporate Services, **BSE Limited**Phiroze Jeejeebhoy Towers, Dalal Street,
Mumbai- 400001, MH

BSE Code: 512453

Dear Sir/Madam

Subject: Newspaper cuttings of published unaudited Financial Results of the Company for the Quarter and Half Year Ending on September 30, 2023.

This is with reference to the captioned subject. Please find enclosed the newspaper cuttings of published unaudited Financial Results of the Company for the Quarter and Half Year ending on September 30, 2023 of the Company in English and Gujarati newspaper paper-Financial Express dated November 10, 2023.

Kindly take note of the same.

Thanking you

Yours truly,

For, Shri Jagdamba Polymers Limited

Mr. Ramakant Bhojnagarwala Managing Director

DIN: 00012733

FINANCIAL EXPRESS

Protium Finance Limited Protium ormerly known as Growth Source Financial Technologies Ltd.

Pahadi Village, Off. The Western Express Highway, Cama Industrial estate, Goregaon (E), Mumbai, Maharashtra- 400063

Registered office at: Nirlon Knowledge Park (NKP) B-2, Seventh Floor,

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, The undersigned being the Authorized Officer of the Protium Finance Limited (ERSTWHILE Growth Source Financial Technologies Ltd.) ("hereinafter referred to as "Protium Finance Limited") under the Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) (SARFAESI Act) and in exercise of powers conferred under Section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 15/02/2023 calling upon the Borrower Krishita Tobacco Through its Proprietor Mr. Jiteshchandra Parshottambhai Patel and Mr. Jiteshchandra Parshottambhai Patel and Mr. Jayantibhai Parshottambhai Patel and Mrs. Priyaben Jiteshchandra Patel to repay the amount mentioned in the notice being Rs. 1,14,59,096/- (Rupees One Crore Fourteen Lakhs Fifty Nine Thousand and Ninety Six Only) as on 15/02/2023 plus further interest & other charges etc. within 60 days from the date of receipt of the said notice. The borrower and others mentioned hereinabove having failed to repay the amount, notice is hereby given to the borrower and others mentioned hereinabove in particular and to the public in general Hon'ble District Collector and Magistrate kheda Nadiad in in exercise of powers conferred on them under Section 14 of the said Act had issued order in Securitization Application No. S.R. No. 66/2023/ vasi/1865/2023 to 1871/2023 on 4thAugust, 2023 to Court Commissioner to take the possession of the secured assets of the secured asset at the location mentioned below. Court Commissioner has taken possession of the property described herein below & handed over possession of the property to the Authorised Officer of Protium Finance Ltd on 7th November, 2023 The borrowers in particular and the public in general is hereby cautioned not to

deal with the property and any dealings with the property will be subject to the charge of Protium Finance Limited, for an amount of Rs. 1,14,59,096/- (Rupees One Crore Fourteen Lakhs Fifty Nine Thousand and Ninety Six Only) as on 15/02/2023 and further interest thereon, plus costs, charges, expenses incurred. DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that right title and interest of property bearing Immovable land bearing Non-

Agricultural plot bearing Block/Survey No.21 A (admeasuring about 4047 Sq. Mtrs. paiki UDS land of 3541.5 Sq.Mtrs), Mouje: Maholel, Taluka: Nadiad, District & Sub-District: Kheda bounded by North: Others (Agri land), South: Others (Agri land), East: Road, West: Others (Agri land) Date : Nadiad **Authorized Officer**

Place: 07.11.2023 (Protium Finance Ltd) Shri Jagdamba Polymers Limited

CIN: L17239GJ1985PLC007829 Registered Office: HARMONY, 4th Floor,15/A, Shree Vidhyanagar Co.op. Hsg. Soc. Ltd. Opp. Nabard, Nr. Usmanpura Garden, Ahmedabad – 380014 • **Tel.**: 079-26565792, **E-mail Id:** admin@jagdambapolymers.com • **Website:** www.shrijagdamba.com Extract of Unaudited Financial Results for the Quarter ended September 30, 2023

_		Ougula	(Rs. In Laki	-
Sr. No.	Particulars	Quarter Ending on 30.09.2023	31.03.2023	Corresponding Three Months Ended in the Previous Year 30.09.2022
		Unaudited	Audited	Unaudited
1	Total income from operations (net)	8709.74	33635.06	10072.17
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1268.72	4108.51	991.50
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	1268.72	4108.51	991.50
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	791.34	3006.26	705.00
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	_	3024.95	_
6	Equity Share Capital	87.58	87.58	87.58
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	<u>-</u>	21233.97	-
8	Face Value Of Equity Share Capital	1.00	1.00	1.00
9	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	9.04	34.54	8.05

with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and company website www.shrijagdamba.com

> For, Shri Jagdamba Polymers Limited Ramakant Bhojnagarwala

> > Branch Name, Address & Contact No.

Ashram Road, Ahmedabad-380006. Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229

Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229

Ellisbridge, Ashram Road, Ahmedabad-380006.

Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mobile No.: 7897810229

Date: 09.11.2023 (Managing Director) (DIN: 00012733) Place: Ahmedabad

Adani Housing Finance Private Limited

Registered Office: Shikhar, Nr. Mithakhali Circle, Navrangpura, Ahmedabad-380009, Gujarat, India Corporate Office: One BKC, C-Wing, 1004/5, 10th Floor, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051. Maharashtra, India.

Housing CIN: U65999GJ2017PTC098960, Website: www.adanihousing.in Finance

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT, 2002 ou the below mentioned Borrowers, Co-borrower(s) / Guarantor have availed loan/s facility(ies) from Adani Housing Finance Private Limited. (the "AHFPL") by mortgaging your immovable properties (Securities). Consequent to your defaults your loans were classified as non-performing assets. Adani Housing Finance Pvt. Ltd. for the recovery of the outstanding dues, issued demand notice under Section 13(2) of The Securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 (the Act), the contents of which are being published herewith as per Section 13(2) of the Act read with rule 3(1) of the Security Interest (Enforcement) Rules, 2002 as and by way of service upon you. Details of the borrowers, co-borrowers, properties mortgaged,

outstanding dues, demand notice sent under Section 13(2) and amount claimed there under are given as under:

Co-Borrower/ Guarantor/ Loan Account No/ Old Loan Account No.	Mortgage Property Address	Demand Notice Date / O/s Amount / O/s Date
Nanuji Thakor / Savitaben / 800HLL001090098	All that pleace and Parcel of Property bearing situated Kharl Vavdi, Gram Panchayat Property No. 484, Assessment serial No. 484, Thakor Vas (Gamthan) admeasuring 350 Sq. ft, Ta & Dist Patan in registration Sub- District of Patan / Bounded as Under : East : Pravinji Meghaji West : Plot of Dhiraji Meghaji North : Navoli Then vishnuji Lalji South: Road	16-Oct-23 Rs.327797/- As On Date 16-Oct-23
Mahendrasingh Mohansingh Sardar / Ishwarikaur M Sardar Ravindrasingh Mahendrasingl Bhamlot / 8010HL001023890	. .,	16-Oct-23 Rs.654405/- As On Date 16-Oct-23

amount with further interest as mentioned herein above in full within 60 days of this notice failing which the undersigned shall be constrained to take action under the act to enforce the above-mentioned securities. Your attention is invited to provisions of subsection (8) of section 13 of the act by virtue of which you are at liberty to redeem the secured asset within period stipulated in the aforesaid provision. Please note that as per section 13(13) of the said act, you are restrained from transferring the above-referred securities by way of sale, lease or otherwise without our consent.

Place: Ahmedabad Date : 10.11.2023

Chola

CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED Corporate Office: Chola Crest, Super B, C54 & C55, 4, Thiru Vi Ka Industrial Estate, Guindy, Chennai - 600 032.

For Adani Housing Finance Private Limited

Authorised Officer

UNDER THE PROVISIONS OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 (" the Act") AND THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 (" the Rules")

DEMAND NOTICE

The undersigned being the Authorized Officer of Cholamandalam Investment and Finance Company Ltd. (the Secured Creditor) under the Act and in exercise of the powers conferred under Section 13(12) of the Act read with Rule 3 issued Demand Notice(s) under Section 13(2) of the Act, calling upon the following borrower(s) to repay the amount mentioned in the respective notice(s) within 60 days from the date of receipt of the said notice. The undersigned reasonably believes that borrower(s) is/are avoiding the service of the Demand Notice(s), therefore the service of notice is being affected by affixation and publication as per Rules. The contents of Demand Notice(s) are extracted herein below :-

Sr.	Name and Address of the Borrower/s		Dt. of Demand	Description of the Property
No.	& Co-Borrower/s		Notice & Amt. O/s.	/ Secured Asset
1.	Loan Account No. (s): X0HLMES00002066636 1. Prakashbhai Amratbhai Aal 2. Rukhiben Amaratbhai Aal 3. Amaratbhai Khengarbhai Aal Both Are R/At: Rajpur B/H Deesa, Market Yard Disa, Gujarat - 385535. Also At: Plot No. 167, Ramauma Society, Himalaya Society Road, Near Apmc Deesa, Gujarat - 385535.	.S.	06.11.2023 Rs. 24,21,857/- (Rupees Twenty Four Lakhs Twenty One Thousand Eight Hundred Fifty Seven Only) as on 30.10.2023	All That Right, Title And Interest of Plot No. 167 P., Admearsuring 56.25 Sq. Mtrs, And Construction Thereon, As Owner of Plot No. 167 P., At. Ganthaman Sim Situated R. S. No. 26+27+28+29 P3, of Rajpur Sim The Registration City Distrcrit of Deesa, Situate Lying And Being At Plot No. 167, Paiki South Side Rama Uma Society Behind Apmc Market Deesa Taluka Deesa Dist. Banaskantha. The Boundaries As Follows: North: Plot No. 167P, South: Plot No. 168, East: Internal Road, West: Land of Mali Mohanbhai Umabhai.

The borrower(s) are hereby advised to comply with the Demand Notice(s) and to pay the demand amount mentioned therein and herein above within 60 days from the date of this publication together with applicable interest, additional interest, bounce charges, cost and expenses till the date of realization of payment. The borrower(s) may note that Cholamandalam Investment and Finance Company Ltd. is a secured creditor and the loan facility availed by the Borrower(s) is a secured debt against the immovable property properties being the secured asset(s) mortgaged by the borrower(s). In the event borrower(s) are failed to discharge their liabilities in full within the stipulated time, The Secured Creditor shall be entitled to exercise all the rights under section 13(4) of the Act to take possession of the secured assets(s) including but not limited to transfer the same by way of sale or by invoking any other remedy available under the Act and the Rules thereunder and realize payment. The Secured Creditor is also empowered to ATTACH AND OR SEAL the secured assets(s) before enforcing the right to sale or transfer. Subsequent to the Sale of the secured assets(s), the Secured Creditor also has a right to initiate separate legal proceedings to recover the balance dues, in case the value of the mortgaged properties is insufficient to cover the dues payable to the Secured Creditor. This remedy is in addition and independent of all the other remedies available to the Secured Creditor under any other law. The attention of the borrower(s) is invited to Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets and further to Section 13(13) of the Act, whereby the borrower(s) are restrained / prohibited from disposing of or dealing with the secured asset(s) or transferring by way of sale, lease or otherwise (other than in the ordinary course of business) any of the secured asset(s), without prior written consent of the Secured Creditor and non-compliance with the above is an offence punishable under Section 29 of the said Act. The copy of the Demand Notice is available with the undersigned and the borrower(s) may, if they so desire, can collect the same from the undersigned on any working day during normal office hours.

Authorised Officer Place: Banaskantha, Gujarat For Cholamandalam Investment and Finance Company Limited Date: 06.11.2023

DIAMOND POWER INFRASTRUCTURE LIMITED

(₹ in Lacs)

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED 30.09.2023

	Particulars		Year Ended		
Sr. No.	ratuculars	30.09.2023	30.06.2023	30.09.2022	31.03.2023
	(Refer Notes below)	Un-audited	Un-audited	Un-audited	Audited
1	Total Income from Operations (net)	7,459.97	7,451.36	3.56	1,571.93
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	348.20	551.90	(879.15)	(4,287.86)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	236.90	551.90	(879.15)	(4,287.86)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	236.90	551.90	(879.15)	(4,287.86)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	236.90	551.90	(879.15)	(4,287.86)
6	Equity Share Capital (Face Value of ₹10/- per share)	5,269.71	5,269.71	5,269.71	5,269.71
7	Earning per share of ₹10/- each (from Continuing and Discontinuing Operations)	(i):	0		859 95 Natio
	Basic (in ₹)	0.45	1.05	(1.67)	(8.14)
	Diluted (in ₹)	0.45	1.05	(1.67)	(8.14)

The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the guarter and half year ended 30th September, 2023 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website(www.dicabs.com).

The above financial results were reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 9th November, 2023.

By order of the Board of Directors, Ahmedabad 9th November, 2023

For Diamond Power Infrastructure Limited Aditya Nayak - Additional Executive Director & CFO (In- charge)

Regd. Office: Phase II, Village Vadadala, Taluka - Savli, Vadodara - 391520 Phone: +91-265-2284328 | Fax: +91-265-2280528 E-mail: tushar.lakhmapurkar@dicabs.com | www.dicabs.com | CIN:L31300GJ1992018198

SHREE RAM PROTEINS LIMITED

CIN: L01405GJ2008PLC054913

Registered Office: IMPERIAL HEIGHTS TOWER-B, SECOND FLOOR, OFFICE NO. B-206, 150 FT RING ROAD, OPP BIG BAZAR RAJKOT-36000: Ph: +912825280634, Fax: +917878036500, Email: cs@shreeramproteins.com; Web: www.shreeramproteins.com

Extract of Unudited Financial Results for the quarter and half year ended on Septemebr 30, 2023

S. N.	Particulars	Quarter ended on 30/09/2023 Unaudited	Quarter ended on 30/06/2023 Unaudited	Quarter ended on 30/09/2022 Unaudited	Half Year Ended 30/09/2023 Unaudited	Half Year Ended 30/09/2022 Unaudited	Year ended on 31/03/2023 Audited
1.	Total Income From Operations	588.75	920.77	4,845.44	1,509.52	10,070.87	16273.47
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-215.1	28.52	151.92	(186.58)	345.71	528.46
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-215.1	28.52	151.92	(186.58)	345.71	528.46
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-189.25	20.59	102.92	(168.66)	239.36	384.53
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-189.33	20.51	103.24	(168.82)	240.01	384.20
6.	Equity Share Capital	2142	2142	2142	2142	2142	2,142.00
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year)		41 - 4				
8	Earnings Per Share (of Rs 1/- each) (for continuing and discontinued operations)-						
	Basic	-0.09	0.01	0.05	(0.08)	0.11	0.18
Ш	Diluted	-0.09	0.01	0.05	(0.08)	0.11	0.18

Note: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and half year ended on September 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the puarter and half year ended on September 30, 2023, is available on the website of Stock Exchange at www.nseindia.com as well as on the Company's Website at vww.shreeramproteins.com. 2.These Unaudited Financial Results have been reviewed by the Audit Committies in its meeting held on November 08, 2023 and were approved by the board of directors in their meeting held on November 08, 2023

Reserve Price and EMD

Only) EMD: Rs. 2,63,800/- (Rupees Two Lacs Sixty-Three Thousand Eight Hundred only).

EMD : Rs. 9,87,700/- (Rupees Nine Lacs Eighty-Seven Thousand Seven hundred only)

EMD: Rs. 1,50,000.00 (Rupees One Lakhs Fifty Thousand only)

For, SHREE RAM PROTEINS LIMITED LALITKUMAR CHANDULAL VASOYA Chairman & Managing Director

DIN: 02296254

(Rs. in Lakh except EPS)

यूनियन बैंक 🕠 Union Bank

Asset Recovery Branch, Ahmedabad, 1st Floor, Rangoli Complex, Opp.V S Hospital, Ashram Road, Ellisbridge, Ahmedabad-380006

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provison to Rule 8(6) / 9(1) of the Security Interest (Enforcement) Rule, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable property mortgaged / charged to the Secured Creditor, the Physical/Symbolic possession of which has been taken by the Authorized Officer of Union Bank of India (Secured Creditor), will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" on the date mentioned below, for recovery of dues as mentioned hereunder to Union Bank of India from the below-mentioned Borrower(s) & Guarantor(s). The Reserve Price and the Earnest Money Deposit are also mentioned hereunder:

DATE AND TIME OF E-AUCTION - 29.11.2023 (Wednesday) from 12:00 p.m. to 05:00 p.m. Name of the Borrower & Guarantor/s Amount due

Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, Opp. V S Hospital Ellisbridge, Mr. Alkesh Dinubhai Patel (Borrower), Rs. 49,80,778.57 Forty-Nine Lacs Eighty Thousand Seven Hundred Seventy Eight and paise Fifty Property No. 1: Reserve Price: - Rs. 33,66,000/- (Rupees-Thirty-Three Lacs Sixty Six Thousand only) Mrs. Venuben Alkeshbhai Patel (Co-Borrower) Ashram Road, Ahmedabad-380006. Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229 Seven Only) as on 31.10.2023 and further interest at contractual rate & cost from 01-11-2023 EMD: - Rs. 3,36,600.00 (Rupees- Three Lacs Thirty Six Thousand Six hundred only) Property No. 1: All that part and parcel of Residential land and Building construction belonging to Mr. Alkeshbhai Dinubhai Patel & Mrs. Venuben Alkeshbhai Datel & Mrs. Venuben Alkeshbhai Dinubhai Patel & Mrs. Venuben Alkeshbhai Dinubhai Pate Other Property, South - Students House / Entry Road. Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Physical Possession) M/s. Shri Harikrishna Stores, Mrs. Kalpana Daxes Patel, Mrs. Daxes Rs. 15,14,001.41 (Rupees- Fifteen Lacs Fourteen Thousand One and Paise Forty One only) Property No. 2: Reserve Price : - Rs.26,38,000/- (Rupees Twenty Six Lacs Thirty Eight Thousand Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, Opp. V S Hospital Elisbridge, Mukundbhai Patel

as on 31-10-2023 and further interest at contractual rate & cost from 01-11-2023.

31.10.2023 and further interest at contractual rate & cost from 01.11.2023.

Paise Ninety Eight Only) as on 31.10.2023 and further interest at contractual

rate & cost from 01-11-2023

Place: Rajkot

Date: November 08, 2023

Property No. 2: All the property consisting of All that piece & Parcel of Immovable property being shop no. 3, on ground floor having area 27.48 Sq. Mtrs. towards the said shop in the land of Abhishek Annexi Association Scheme known as "Raj Avenue Complex", situated on residence purpose non agriculture use land, bearing T.P.S. No. 4, F.P.No. 129-132-133-136 paiki Sub Plot No. 17 of Mouje KHOKHARA-MEHMDAVAD Village Sim, Taluka - Maninagar, District & Sub District & Sub District & Sub District Ahmedabad - (Narol), held in the name of Mrs. Kalpana Daxesh Patel which is Bounded by: North: Common Passage & way to Basement, South: Shop No. 2, East: Passage & West: Road Details of encumbrances over the property, as known to the secured creditor, if any: North: Common Passage & Stair Case, West: Road Details of encumbrances over the property. M/s M Rajeshkumar Proprietor Mr Ashish Rajeshbhai Makhijani, Rs. 73,56,313.56 Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, 3 Reserve Price: Rs. 29.59,000.00 (Rupees Twenty Nine Lacs Fifty Nine thousand only) Mrs Deepa Rajeshbhai Makhijani (Rs. Seventy-Three Lacs Fifty Six Thousand Three Hundred Thirteen and paise Fifty Six only) Opp. V S Hospital, Ellisbridge, Ashram Road, Ahmedabad-380006. Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229 as on 31.10.2023 and further interest at contractual rate & cost from 01-11-2023. EMD: 2,95,900.00 (Rupees Two Lac Ninety Five Thousand Nine Hundred only)

Property No. 3: All that piece and parcel of the immovable constructed property Block no. 165/A/3 admeasuring land area about 49-53-00 sq. mts. Bearing municipal tenement no. 0226-33-0341-0003-9, Ahmedabad Electricity consumer no. 198013 bearing city survey no. 893 paiki hissa no. 3, Sim Sardarnagar, Taluka city, Registration District & Sub-District Ahmedabad. Owned by Mrs. Deepa Rajeshkumar Makhijani bounded by : East : Block No. 165/A/2 with common wall, West : Block No. 165/A/2 with common wall, North : City survey No. 925, South : Entrance door and Municipal public Road Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Physical Possession) M/s. Hetashvi Enterprise, Mr. Gaurangkumar Vinodray Vaishnav, Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, Rs. 34,13,219.78 Property No. 4:

Mr. Anil Kumar Mundra S/o. Mr. Niranjankumar Mundra (Rs. Thirty-Four Lacs Thirteen Thousand Two Hundred Nineteen and paise Seventy Eight Only) Reserve Price: Rs. 11,81,000/- (Rupees Eleven Lacs Eighty One Thousand only) Opp. V S Hospital, Ellisbridge, Ashram Road, Ahmedabad-380006. as on 31.10.2023 and further interest at contractual rate & cost from 01-11-2023 EMD: Rs. 1,18,100/- (Rupees One Lacs Eighteen Thousand One Hundred only) Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229 Property No. 4: All the part and parcel of the property belonging to Mr. Gaurangkumar Vinodray vaishnav, situated at Flat no. 302, Block-C, 3rd Floor, Shraddha Pioneer, Opp. Radhe Upvan Club, Mahemdavad Road, Sub Plot No. 1, F.P. No. 23/2, 24,25,31 T.P. Scheme No. 78, Block No. 200, 201, 202 paikl 201, Hathijan, Ahmedabad district and bounded by: East: Stair & Flat No. C-303, North

Common Road, West: Common Margin, South: Flat No. C-301 Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Physical Possession) M/s Gotiz Healthcare Limited (Borrower), Ms. Roshni Rajendra Goti Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, Rs. 4.46.03.148.00 Property No. 5: Reserve Price: Rs. 98,77,000/-5 (Guarantor), Ms. Kailashben Rameshbhai Goti (Guarantor), Mr. Amit (Rupees Four crores Forty Six Lacs Three Thousand One Hundred Forty Eight only) as on (Rupees Ninety Eight Lacs Seventy-Seven Thousand only) Opp. V S Hospital, Ellisbridge, Ashram Road, Ahmedabad-380006.

Property No. 5: M/S. Gotiz Healthcare Limited M.D. Mr. Rajendra M. Goti. (A) All that Part and parcel of the immovable property situated at Shop no. 1 admeasuring 13.52 sq. mt., Shop no. 2 admeasuring 13.52 sq. mt., Shop no. 2 admeasuring 13.52 sq. mt., Shop no. 3 admeasuring 13.52 sq. mt., Shop no. 3 admeasuring 13.52 sq. mt., Shop no. 4 admeasuring 13.52 sq. mt., Shop no. 4 admeasuring 13.52 sq. mt., Shop no. 5 in the immovable property situated at Shop no. 6 admeasuring 13.52 sq. mt., Shop no. 7 admeasuring 13.52 sq. mt., Shop no. 8 admeasuring 13.52 sq. mt., Shop no. 8 admeasuring 13.52 sq. mt., Shop no. 9 admeasuring 13.52 sq. Shopping Mall at mouje - Palej village, Dist - Bharuch with survey no. 2369/b and Block no. 268, 269 and 270. Shop No.: 1 to 4: East: Open Passage, West: Open Passage, West: Open Passage, Worth: Shop No. 38-39, South: Open Passage, West: Open Passage, Worth: Shop No. 38-39, South: Open Passage, West: Open Passage, Worth: Shop No. 268, 269 and 270. Shop No.: 1 to 4: East: Open Passage, West: Open Passage, North: Shop No. 268, 269 and 270. Shop No.: 1 to 4: East: Open Passage, North: Shop No. 268, 269 and 270. Shop No.: 1 to 4: East: Open Passage, North: Shop No. 268, 269 and 270. Shop No.: 1 to 4: East: Open Passage, North: Open Passag sq. mt., Shop no. 8 admeasuring 13.52 sq. mt. and undivided share of land admeasuring 12 sq. mt of each shop in second floor of High Cross Shopping Mall at mouje - Palej village, Distt - Bharuch with survey no. 2369/b and Block no. 268, 269 and 270. Shop No.: 5 to 8: East: Open Passage, West: Open Passage immovable property situated at Shop no. 9 admeasuring 13.61 sq. mt., Shop no. 10 admeasuring 13.61 sq. mt., Shop no. 11 admeasuring 13.61 sq. mt., Shop no. 12 admeasuring 13.61 sq. mt., Shop no. 12 admeasuring 13.61 sq. mt. and undivided share of land admeasuring Shop No.: 9 to 12: East: Open Passage, West: Shop No. 51-54, North: Shop No. 13, South: Shop No. 14 admeasuring 13.61 sq. mt., Shop no. 14 admeasuring 13.61 sq. mt., Shop no. 15 admeasuring 13.61 sq. mt., Shop no. 16 admeasuring 13.61 sq. mt., Shop no. 17 admeasuring 13.61 sq. mt., Shop no. 18 admeasuring 13.61 sq. mt., Shop no. 19 admeasuring 13.61 sq. mt., Shop no. in second floor of High Cross Shopping Mail at mouje - Palej village, Distt - Bharuch with survey no. 2369/b and Block no. 268, 269 and 270. Shop No. 17 admeasuring 11.34 sq. mt., Shop no. 17 admeasuring 11.34 sq. mt., Shop no. 18 admeasuring 11.34 sq. mt., Shop no. 19 admeasuring 11.34 sq. mt., Shop no. 20 admeasuring 11.34 sq. mt., Shop no. 20 admeasuring 11.34 sq. mt. of each shop in second floor of High Cross Shopping Mall at mouje - Palej village, Distt - Bharuch with survey no. 2369/b and Block no. 268, 269 and 270. Shop No.: 17 to 20: East: Open Passage, West: Shop No 21, North: Open Land, South: Open Passage, (F) All that Part and parcel of the immovable property situated at Shop no. 31 admeasuring 13.61 sq. mt., Shop no. 32 admeasuring 13.61 sq. mt., Shop no. 33 admeasuring 13.61 sq. mt., Shop no. 33 admeasuring 13.61 sq. mt., Shop no. 34 admeasuring 13.61 sq. mt., Shop no. 34 admeasuring 13.61 sq. mt., Shop no. 35 admeasuring 13.61 sq. mt., Shop no. 36 admeasuring 13.61 sq. mt., Shop no. 36 admeasuring 13.61 sq. mt., Shop no. 37 admeasuring 13.61 sq. mt., Shop no. 38 admeasuring 13.61 sq. mt., Shop no. 38 admeasuring 13.61 sq. mt., Shop no. 38 admeasuring 13.61 sq. mt., Shop no. 39 admeasuring 13.61 sq. mt., Shop no. 30 admeasuring 13.61 sq. mt. Block no. 268, 269 and 270. Shop No.: 31 to 34: East: Shop No. 35 admeasuring 13.61 sq. mt., Shop no. 36 admeasuring 13.61 sq. mt., Shop no. 36 admeasuring 13.61 sq. mt., Shop no. 37 admeasuring 13.61 sq. mt., Shop no. 38 admeasuring 13.61 sq. mt. and undivided share of land admeasuring 12 sq. mt of each shop in second floor of High Cross Shopping Mall at mouje - Palej village, Distt - Bharuch with survey no. 2369/b and Block no. 268, 269 and 270. Shop No.: 35 to 38: East: Shop No. 39-42, West: Open Passage, North: Shop No. 34, South: Shop No. 34, South: Shop No. 34, South: Shop No. 34, South: Shop No. 35 to 38: East: Shop No. 36, South: Shop No. 37, Shop No. 38, South: Shop No. 38, South: Shop No. 38, South: Shop No. 39-42, West: Open Passage, North: Open Passage, N no. 44 admeasuring 13.61 sq. mt., Shop no. 45 admeasuring 13.61 sq. mt., Shop no. 45 admeasuring 13.61 sq. mt., Shop no. 46 admeasuring Open Passage, South: Shop No 42, (I) All that Part and parcel of the immovable property situated at Shop no. 49 admeasuring 13.61 sq. mt., Shop no. 40 admeasuring 13.61 sq. m Distt - Bharuch with survey no. 2369/b and Block no. 268, 269 and 270. Shop No.: 47 to 50: East: Shop No. 51 admeasuring 13.61 sq. mt., Shop no. 52 admeasuring 13.61 sq. mt., Shop no. 53 admeasuring 13.61 sq. mt., Shop no. 53 admeasuring 13.61 sq. mt., Shop no. 54 admeasuring 13.61 sq. mt.

13.61 sq. mt. and undivided share of land admeasuring 12 sq. mt of each shop in second floor of High Cross Shopping Mall at mouje - Palej village, Dist: - Bharuch with survey no. 2369/b and 270. Shop No 5.0, South: Shop No 5.0 creditor, if any: None (Symbolic Possession) M/s. Arihant Industries. Mrs. Manjulaben Jitendrakumar Bhaysar, Mrs. Manjshaben Union Bank of India, Asset Recovery Branch Property No. 6: at First Floor, Rangoli Complex, Opp. V S Hospital, Nirajkumar Bhavsar, Mrs. Pushpaben Ashokbhai Patel, Mrs. Punitaben Jitendrakumar (Rupees Five Crores Fifty Four Lacs Three Thousand One Hundred Eighty Eight and Reserve Price : - Rs.15,00,000.00 (Rupees Fifteen Lakhs only)

Property No. 7: Property No. 6: All the Part and parcel of Residential property Situated at city survey No. 4007/6 paiki, ward No. 1, Block No. 7, admeasuring 59.99 Sq. Yards, Nr. Rupali Ba Temple, Alka Chowk, Nava Junction Road, Surendranagar, Wadhwan, Gujarat, the said property is owned by Mr. Rajeshbha Reserve Price: - Rs.66,30,000.00 (Rupees Sixty-Six Lakhs Thirty Thousand only) Dalsukhbhai Malvania & Mr. Nirajkumar Jitendra Kumar Bhavsar which is bounded as follows: As per sale Deed: North: 30'ft Road, South: 20'ft Road, South: Property of Plot No. 6 Paiki, West: Property of Plot No. 6 Paiki, As on Site: North: Road, South: Road, East: House at Block No. 6, West: House EMD: Rs.6,63,000.00 (Rupees Six lakhs Sixty-Three Thousand only) at Block No. 8. Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Symbolic Possession) Property No. 7: All the Part and parcel of property is owned by Mr. Sureshbhai Bhikhabhai Patel which is bounded as follows: North: Naliya

Marg, South: Old Survey No.613(property of Maruti Cotton Mill), East: Old Survey No.609 (Padmavati oil Mill), West: Old Survey No.608/1 & 608/2. Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Symbolic Possession) Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, Opp. V S Hospital, Elisbridge, M/S Shaurya Corporation, Property No. 8: Reserve Price: Rs. 91,80,000/- (Rupees- Ninety- One Lacs Eighty Rs. 69,90,894.18 (Rs. Sixty-Nine Lacs Ninety Thousand Eight Hundred Ninety Four & Paise Ashram Road, Ahmedabad-380006. Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mobile No.: 7897810229 Mrs. Leena Hiral Shah, Mr. Gaurav Maheshbhai Shah Thousand only), EMD :Rs. 9,18,000/- (Rs. Nine Lacs Eighteen Thousand Only) Eighteen only) as on 31.10.2023 and further interest at contractual rate & cost from 01-11-2023.

Property No. 8: All that piece and parcel of immovable commercial property bearing City Survey No. 5302, City Mouje Surendranagar, Opp. Wadhvan's Utara, Surendranagar, Coperty, East - Road. West - Common wall then other's property, Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Symbolic Possession) M/s. AD Builders, Mr. Dharmendra Jagdishchandra Shah

Union Bank of India, Asset Recovery Branch Rs. 1,06,35,008.51 Property No. 9 : Reserve Price : Rs. 6,17,000/at First Floor, Rangoli Complex, Opp. V S Hospital, Ellisbridge, Ashram Road. Mr. Jogindrasingh Chhabra, Mr. Mahendra Nandlal Kela (Rupees One Crore Six Lakh Thirty Five Thousand Eight and Paise Fifty One Only) as on (Rupees Six Lakh Seventeen Thousand only) Ahmedabad-380006. Contact Person: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229 31.08.2023 and further interest at contractual rate & cost from 01.09.2023. EMD: Rs. 61,700/- (Rupees Sixty One Thousand Seven Hundred Only)

Property No. 9: All that Part & Parcel of Sub Plot no. E-77, Greenland the Eco village, Near Aniyari Gam, Bayla to Nalsarovar Road, R. Survey no. 481 paiki, At/ Village Zamp, Taluka sanand, Ahmedabad, 382110 owner name -Mr. Mahendra Nandlal Kela and bounded as under: North: Open Sub plot no. E/78, South: Open Sub plot no. E/76, East: Road, West: Open

Sub plot no. E/62 SA No. 350 of 202 in DRT-1, Ahmedabad (Symbolic Possession)

Mr. Himanshu N Patel Union Bank of India, Asset Recovery Branch at First Floor, Rangoli Complex, Opp. V S Hospital, Ellisbridge, Property No. 10: Reserve Price: Rs. 3,25,000.00 Rs. 35,12,716.19 (Rupees-Thirty-Five Lakhs Twelve Thousand Seven Hundred Sixteen and paise

Ashram Road, Ahmedabad-380006, Contact Person : Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229 Nineteen only) as on 31.08.2023 and further interest at contractual rate & cost from 01.09.2023 (Rupees- Three Lacs Twenty-Five Thousand only) EMD: Rs. 32,500.00 (Rupees Thirty-Two Thousand Five Hundred only) Property No. 10: Vehicle Model-Ashok Leyland AL PSR 3/106 (Bus), Reg No. GJ01 DZ8483, Chassis No. MB1 PEEA DXG EDU 7939, Engine No. GEZ 201922, Class of Vehicle Bus Luxury Coach Details of encumbrances over the property, as known to the secured creditor,

Property No. 11: Vehicle Model - Ashok Leyland AL PSR 3/46 23 (Bus), Reg. No. GJ01 DZ7281, Chassis No. MB1 PEEA D7G AEF 3252, Engine No. GFEZ 200549, Class of vehicle Bus Luxury Coach Details of encumbrances over the property, as known to the secured creditor, if any: None (Physical Possession)

Bhavsar, Mr. Sureshkumar Bhikalal Patel, Mr. Rajeshbhai Dalsukhbhai Malvaniya,

Vinubhai Goti (Guarantor), Mr. Rajendra Mavjibhai Goti (Guarantor),

Contact Details: Mr. Ranjan Kumar Mishra, Mo.: 7897810229, Mr. Ashutosh Kumar, Mobile No.: 79909 14505 This may also be treated as statutory 15 days sale notice u/r 8(6) / 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to the borrower(s) and guarantor(s) of the above said loan, about the holding of E-Auction Sale on the above mentioned date.

Date and Time of inspection for properties: as per consultation with Branch Manager.

For detailed terms and condition of the sale, please refer to the link provided in https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

Ahmedabad

Authorised Officer, Union Bank of India

Property No. 11: Reserve Price: Rs. 3,25,000.00 (Rupees- Three Lacs Twenty-Five Thousand only)

EMD : Rs. 32,500.00 (Rupees Thirty-Two Thousand Five Hundred only)

financialexp.epapr.in

9

Date: 06.11.2023, Place: Ahmedabad

Mr. Nirajkumar J Bhavsar

શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ CIN: L17239GJ1985PLC007829 **રિજિસ્ટર્ડ એક્સિ:** હાર્મની, 4થો માળ, 15/એ, શ્રી વિદ્યાનગર કો. ઓપ. હાઉ. સો. લિ., નાબાર્ડની સામે, ઉસ્માનપુરા ગાર્ડન પાસે, અમદાવાદ – 380014 • **ડેલિકોન નં**: 079-26565792

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

- મલઃ admin@jagdambapolymers.com	<u>• વબસાઇટ</u>	🕻 www.shrija	gdamba.com
મ્બર ૩૦, ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર	માટે અનએડિ	ટેડ નાણાકીય	પરિણામોનો અર્ક
		(ઇપીએસ સિવ	ાથ લાખોમાં રૂ.)
	ત્રિમાસિક	વર્ષના	પાછલા વર્ષ
62.4	ગાળાના	અંતે	30.06.2022
ાવગત		39 03 2022	માં અનુરૂપ ત્રણ
			મહિના પૂરા થયા
	અનઆડિટેડ	અાડિટેડ	અનઓડિટેડ
કામગીરીમાંથી કુલ આવક (નેટ)	८७०५.७४	33६3५.०६	१००७२.१७
સમયગાળા માટે ચોખ્ખો નફો (કર પહેલાં,	૧૨૬૮.૭૨	४१०८.५१	૯૯૧.૫૦
, , ,			
	૧૨६૮.૭૨	४१०८.५१	૯૯૧.૫૦
,	.060.2V	3005.35	૭૦૫,૦૦
નકો (અસાધારણ અને/અથવા	961.38	3004.84	604.00
અસાધારણ વસ્તુંઓ પછી)			
સમૂચગાળા માટે કુલ વ્યાપક આવક (કર્	_	3028.64	_
પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી)		0 - 00.0 0	
ઇક્વિટી શેર કેપિટલ	८७.५८	૮૭.૫૮	८७.५८
પાછલા વર્ષની બેલેન્સ શીટમાં બતાવ્યા	-	૨૧૨૩૩.૯૭	-
,			
η σ. σ	9.00	9.00	9.00
	6.08	૩૪.૫૪	૮.૦૫
	ખર 30, 2023 ના રોજ પ્રા થયેલા ક્વાર્ટર વિગત કામગીરીમાંથી કુલ આવક (નેટ) સમયગાળા માટે યોખ્ખો નફો (કર પહેલાં, અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ) કર પહેલાંના સમયગાળા માટે યોખ્ખો નફો, (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી) કર પછીના સમયગાળા માટે ચોખ્ખો નફો (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી) સમયગાળા માટે કુલ વ્યાપક આવક (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી) ઇક્વેટી શેર કેપિટલ	ખર 30, ૨૦૨૩ ના રોજ પૂરા થેથેલા ક્લાર્ટર માટે અન્સ્રોહિ વિગત વિગત વિ	વિગત વર્ષના અતાળના ગળાના ગળાન ગળાન

નોંધ: ઉપરોક્ત SEBI (લિસ્ટિંગ અને અન્ય ડિસ્ક્લોઝર જરૂરીયા તો) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમન 33 ફેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો એક અર્ક છે. ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ છે. સ્ટોક એક્સચેન્જ વેબસાઇટ એટલે કે www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.shrijagdamba.com. **શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ**

રમાકાંત ભોજનગરવાલા (મેનેજિંગ ડિરેક્ટર) (ડીઆઈએન: ૦૦૦૧૨૭૩૩) તારીખઃ ૦૯.૧૧.૨૦૨૩ સ્થળઃ અમદાવાદ



પહેલાં અને પછી) મૂળભૂત / પાતળું:

રીજનલ ઓફિસ, અમદાવાદ : દી સાઉથ ઈન્ડિયન બેંક લિં, રીજનલ ઓફિસ અમદાવાદ : ચોથો માળ, સાકાર - VII, નેહ3 બીજ જંકશન. આશ્રમ રોડ, નવરંગપરા અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૯, ફोन नं. ०७६-२५४८५५००, ५७०० धभेल : ro1018@sib.co.in

RO-AHM/0777/SH/SAR/SALE/68/2023-24, Date: 07.11.2023 પરિશિષ્ટ - ૪-એ (નિયમ ૮(૬)) સ્થાવર મિલકતોના વેચાણ માટે ટેન્ડર કમ હરાજી વેચાણ નોટીસ એકાઉન્ટ નં. મે. નિમા ફેશન (પ્રો. શ્રી મનોજ કનેચાલાલ શર્મા), શાખા-મણીનગર

સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (અધિનિયમ) ૨૦૦૨ તથા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈ હેઠળ સ્થાવર મિલકતોનું હરાજીથી વેચાણની વેચાણ માટેની ટેન્ડર કમ ઓકશન વેચાણ નોટીસ.

આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉધારકર્તા અને જામીનદારોને સૂચના આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત **દી સાઉથ ઇન્ડિચન બેંક લિં. મણીનગર** શાખ (મુકરર દેવાદારો) પાસે ગીરો / ચાર્જ કરેલ છે, જેનો પ્રત્યક્ષ કબજો તા. ૨૯.૧૦.૨૦૨૩ ના રોજ ધી સાઉથ ઇન્ડિયન બેંક લિમીટેડ, રીજનલ ઓફિસ, અમદાવાદ (મુકરર દેવાદાર) ના અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવી છે જે <mark>"જે જેમ છે ત્યાં છે" "જેમ છે તેમ" અને "જે ત્યાં છે તેમ</mark>' (સુરક્ષીત સંપત્તિઓનાં અસત્ય, પ્રકૃતિ અને ભૌતિક સ્થિતીમાં સંદર્ભે) વેચાણ કરવામાં આવશે. તા. વર્કે. ૧૨.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યા (વેચાણની તારીખ) દી સાઉથ ઇન્ડિયન બેંક લિમીટેડ, મણીનગર શાખા, શીવદીપ બિલ્ડીંગ, બીઆરટીએસ સ્ટેક્ડની પાસે, મણીનગર રેલ્વે સ્ટેશનની સામે, મણીનગર, અમદાવાદ - ૩૮૦૦૦૮ (વેચાણનું સ્થળ) ની રકમની વસુલાત માટે ની રકમ રૂા. ૨,૦૮,૪૨,૨૦૫.૦૨ (રૂપિયા બે કરોડ ઈઠયોત્તેર લાખ બેત્તાલીસ હજાર બસ્સો પાંચ અને પૈસા બે પુરા) તા. ૦૬.૧૧.૨૦૨૩ સુધીના, બાકી લ્હેંણી રકમને કારણે લોન એકાઉન્ટ મે. નિમા ફેશન (પ્રોપ્રાઈટર - શ્રી મનોજ કનૈયાલાલ શર્મા, શાખા - મણીનગર દ્રારા ઉધારકર્તાઓ પાસેથી ચડત વ્યાજ, કોસ્ટ અને ખર્ચાઓ (મુકરર દેવાદાર) સાથે (૧). શ્રી મનોજ ક્નેચાલાલ શર્મા (પ્રોપ્રાઈટર : મે. નિમા ફ્રેશન), ૨૦૫, શીવેદિપ એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ** : બી-૪૨, રાજરત્ના બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલફાર્મ હાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં** પણ : બી-૭૭, ઉપાસના રાજબાગ સોસાયટી, ઘોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦ અને જામીનદારો : - (૨). શ્રીમતી સરોજબેન શર્મા @ સરોજદેવી શર્મા @ શર્મા શરોજદેવી કનૈયાલાલ, ૨૦૫, શીવદિપ એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ** : બી-૪૨, રાજરત્ના બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલ ફાર્મ હાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં પણ** બી-૭૭, ઉપાસના રાજબાગ સોસાયટી, ઘોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦, (**૩). શ્રીમતી** વિમળા શર્મા, ૨૦૫, શીવદિપ એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ** : બી-૪૨ રાજરત્ના બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલ ફાર્મ હાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં** up: બી-૭૭. ઉપાસના રાજબાગ સોસાયટી. ઘોડાસર કેનાલ રોડ. અમદાવાદ - ૩૮૦૦૫૦ અનામત કિંમત : રૂા. ૧,૩૧,૦૦,૦૦૦/- (અંકે રૂા. એક કરોડ એક્ત્રીસ લાખ પુરા) અને અર્નેસ્ટ મની ડિપોઝીટ : રૂા. ૧૩,૧૦,૦૦૦/- (અંકે રૂા. તેર લાખ દસ હજાર પુરા).

(મિલકતના માલિકનું નામ : શ્રી મનોજ કનૈયાલાલ શર્મા અને સરોજબેન શર્મા) મિલકતનું વર્ણન : મનોજ કનૈયાલાલ શર્મા અને સરોજબેન શર્માની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૧૯૪.૮૨ સ્કે.મી. બિલ્ડીંગ સાથે, બી-૪૨, અન્ય તમામ બાંધકામો, સુધારાઓ તેના પર અસ્તિત્વમાં રહેલા અને અનુરૂપ સરળતાના અધિકારો સાથે, રાજરત્ન (ઘોડાસર) કો. ઓ. હાઉસીંગ સોસાયટી લિ. થી જાણીતી સ્કીમ, જે સ્થિત જમીનનો સર્વે નં. ૫૮, ૬૧, ૬૨ પૈકી, એફ.પી. નં. ૧૨૬, ટીપીએસ નં. ૪૫, એમ.બી. પટેલ ફાર્માની પાસે, ઘોડાસર ગામ, તાલુકો - સીટી, હવે મણીનગર, જીલ્લો - અમદાવાદ, વેચાણ ડીડ નં. દદ૦૬/૨૦૦૬, તા. ૦૪.૧૨.૨૦૦૬, સબ રજીસ્ટ્રાર ઓફિસ - અમદાવાદ - ૫ (નારોલ). ચતુઃસીમા :- ઉત્તરે : રોડ, દક્ષિણે : ફાઈનલ પ્લોટ નં. ૧૨૫ (ચંદન સોસાયટી), **પૂર્વે** : રોડ, પશ્ચિમે : યુનિટ નં. બી-૪૧. (બેંકને જાણમાં બોજો : નથી)

-વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને સાઉથ ઈન્ડિયન બેંક લિમીટેડ (મુકરર દેવાદાર), વેબસાઈટ: www. southindianbank.com માં આપેલી લિંકનો સંદર્ભ લો.

અધિકૃત અધિકારી, ધી સાઉથ ઈન્ડિયન બેંક લિ



EURO INDIA FRESH FOODS LIMITED

(Formerly known as Euro India Fresh Foods Private Limited)
office: A-22/1, Ichhapore GIDC, Hazira-Magdala Road, Surat-394510, Gujarat, India CIN: L15400GJ2009PLC057789. Email ID: investor@euroindiafoods.co

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30,2023

(Rs. in Lakhs, except EPS) Half Year Quarter Quarter **Particulars** ended on ended on ended on 30.9.2023 30.9.2023 30.9.2022 (Unaudited) (Unaudited) (Unaudited) 1. Revenue from Operations 2689 5477 3693 2. Profit before Exceptional 82 126 45 Items and Tax 3. Profit before Tax 82 126 45 Profit for the period 82 126 45 Total Comprehensive 82 128 49 Income (after Tax) 6. Paid up Equity Share 2480 2480 2480 Capital (of Rs. 10 each) 7. Earnings per Equity Share (a) Basic - Weightage 0.33 0.51 0.18 (b) Diluted

'Reserves for the year ended March 31, 2023, were Rs. 3849 Lakhs Notes:

- 1) The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, is available on the website of the National Stock Exchange of India Limited at www.nseindia.com and the website of the Company at www.euroindiafoods.com.
- 2) The above Unaudited Standalone Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, were reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board of Directors at their Meeting held on Wednesday, November 08, 2023.
- The Limited Review as required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the Statutory Auditor of the Company

For, EURO INDIA FRESH FOODS LIMITED

Place: Surat Javnika Gandharva Date: November 08, 2023 Company Secretary & Compliance Officer



કેમકક્ષ એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ

સી.આઇ.એન : એલ૦૧૧૧૦જીજે૧૯૯૬પીએલસી૦૨૯૩૨૯ રિજ.ઓફિસ: ૩૩૦, ટ્રિવિયા કોમ્પલેક્ષ, નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૭ ઇ-મેલ: girishshah@chemcrux.com ફોન: ૦૨૬૫-૨૯૮૪૮૦૩/૨૯૮૮૯૦૩ वेअसाधर: www.chemcrux.com

૩૦મી સપ્ટેમ્બર ર૦૨૩ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વર્ષના અનઓડિટેડ સ્ટેન્ડઅલોન

σ	તાણાકીય પરિ	ણામોનો નિવે	દન	(રુપિયા લાખો	માં શેર દીઠ કમ	ાણી સિવાય)
						વર્ષના અંતે
વિગતો	૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ)	૩૦મી જૂન ૨૦૨૩ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ)	૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ)	ર૦૨૩ સમાપ્ત થયેલ અર્ધ વર્ષ	૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ સમાપ્ત થયેલ અર્ધ વર્ષ અંતે (અનૉડિટેડ)	૩૧/૦૩/૨૦૨૩ (ઓડિટેડ)
કામગીરીથી કુલ આવક (નેટ)	9,509.59	૨,૨૪૬.૯૭	२,८०५.४८	૩૮૫૪.૬૩	પપ૨૧.૦૫	૯૬૨૦.૪૫
સમયગાળા માટે ચોખ્ખો નફો/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ)	19८.31	315.11	૫૫૦.૯૭	४७४.४०	૧,૦૬૭.૭૫	૧,૯૬૪.૭૯
સમયગાળા માટે ચોખ્ખો નફો/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	192.31	315.11	૫૫૦.૯૭	४७४.४०	૧,૦૬૭.૭૫	૧,૯૬૪.૭૯
સમયગાળા માટે ચોખ્ખો નફો/ નુકશાન કર પછી, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	૧૨૪.૪૪	२3२.५२	૪૦૨.૫૭	૩૫૭.૦૫	૭૮૫.૬૨	૧,૪૩૫.૮૧
સમયગાળા માટે કુલ સમગ્રહલક્ષી આવક (તે સમય ગાળા માટે નફો/નુકશાનનો સમાવેશ કર પછી) અને અન્ય સમગ્રહલક્ષી આવક કર પછી		૨૫૮.૭૯	802.59	39८.२9	9 ૯ ૪.૧૦	૧,૪૬૮.૪૨
ઇકિવટી શેર મુડી (ફેસ વેલ્યુ રુ.૧૦/- પ્રતિ શેર)	1860.66	1860.66	1860.66	1860.66	1860.66	1860.66
પુર્નમુલ્યાંકન અનામત સિવાયની અન્ય ઇકિવટી	-	-	-	-	-	૫૧૫૯.૭૦
શેરદીઠ કમાણી (દરેક રુ.૧૦/- ની) ૧. મૃળભૃત (રુ. મા)	0.28	૧.૫૭	ર.૭૨	ર.૪૧	૫.૩૧	৬.৩০
	વિગતો કામગીરીથી કુલ આવક (નેટ) સમયગાળા માટે ચોખ્ખો નકો/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ) સમયગાળા માટે ચોખ્ખો નકો/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી) સમયગાળા માટે ચોખ્ખો નકો/ નુકશાન કર પછી, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી) સમયગાળા માટે શ્રુલ સમયઅહલક્ષી આવક (તે સમય ગાળા માટે નકો/નુકશાનનો સમાવેશ કર પછી) અને અન્ય સમગ્રહલક્ષી આવક કર પછી ઇકિવટી શેર મુડી (ફેસ વેલ્યુ રુ.૧૦/- પ્રતિ શેર) પુર્નમુલ્યાંકન અનામત સિવાયની અન્ય ઇકિવટી શેરદીઠ કમાણી (દરેક રુ.૧૦/- ની)	વિગતો 3ન્મી સપ્ટેમ્બર કુલ્લ સુલ્લ આવક (નેટ) ૧૬૦૭.5 ક્રમગીરીથી કુલ આવક (નેટ) ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૭.5 ૭ ૧૬૦૦.5 ૧૯૦૦.5 ૧૬૦૦.5 ૧૯૦	ક્લાર્ટરના અંગી સપ્ટેમ્બર કરાઈટરના અંગી સપ્ટેમ્બર કરાઈટરના અંગી સપ્ટેમ્બર કરાઈટરના અંગ કર્યાં સ્વાર્ય કરાઈટરના સ્વાર્ય કર્યા કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા સ્વાર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા સ્વાર્ય કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર	કવાર્ટરના અંતે 30મી સપ્ટેમ્બર સુરુર સ્વાર્ટરના અંતે 30મી સપ્ટેમ્બર સુરુર સ્વાર્ટરના અંતે 30મી સપ્ટેમ્બર સુરુર સ્વાર્ટરના અંતે સુરુર કવાર્ટરના અંતે સુરુર મામગાળા માટે ચોખ્ખો નદી/ નુકશાન કર પહેલા, (અપવાદરુપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી) ૧૭૮.૩૧ ૩૧૬.૧૧ પપ૦.૯૭ ૫૫૦.૯૭ ૧૭૮.૩૧ ૩૧૬.૧૧ પપ૦.૯૭ ૧૭૮.૩૧ ૩૧૬.૧૧ પપ૦.૯૭ ૧૭૮.૩૧ ૩૧૬.૧૧ પપ૦.૯૭ ૧૭૮.૩૧ ૩૧૬.૧૧ ૫૫૦.૯૭ ૧૭૮.૩૧ ૩૧૬.૧૧ ૫૫૦.૯૭ ૧૫૦.૯	(સ્પાયમાં માસ મર્ચવા મામા કર્યા કર્	(સ્પાયમાં મારા સર દાઇ કર્યા કરી માર્ગ કર્યા કરી માર્ગ કર્યા કર્યા કર્યા કર્યા માર્ગ કર્યા કર્યા કર્યા માર્ગ કર્યા કર્ય કર્યા કર્યા માર્ગ કર્યા

- ૧. ઉપરોક્ત અનઓડિટેડ સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામોની ઓડિટ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૦૯મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ યોજાયેલી તેમની સંબંધિત બેઠકોમાં મંજુર કરવામાં આવી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધ વર્ષના આંકડાઓ વૈદ્યાનિક ઓડિટર્સ દ્વારા મર્યાદિત સમીક્ષાને આધિન છે.
- ર. પાછવા વર્ષોના આંકડાઓ ફરીથી જૂથબાદુ કરવામાં આવ્યા છે અને જરુરી હોય ત્યાં પુનઃવર્ગીકરણ કરવામાં આવ્યા છે. 3. ઉપરોક્ત સેબી (લિસ્ટિંગ અને અન્ય ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્રસ) રેગ્યુલેશન્સ, રુળપના નિયમન ૩૩ હેઠળ બીએસઈ સ્ટોક એક્સયેન્જ (બી એસ ઈ) સાથે ફાઇલ કરાયેલ ત્રિમાસિક અને અર્ય વાર્ષિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો અર્ક છે. ત્રિમાસિક અને અર્ય વાર્ષિક નાણાકીય

પરિણામો નું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સયેન્જની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.chemcrux.com પર ઉપલબ્ધ છે બોર્ડના આદેશથી

કેમકક્ષ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ વતી સહી/- ગિરીશકુમાર શાહ (હૉલ ટાઈમ ડિરેક્ટર) સ્થળ: વડોદરા તારીખ: ૦૯મી નવેમ્બર ૨૦૨૩ (DIN: ookseren)

કોર્પોરેટ ઓફિસ : ચોલા ક્રેસ્ટ, સુપર બી, સીપ૪ અને સીપપ, ૪, થીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગિન્ડી, ચેન્નાઈ ૬૦૦૦૦૧

આથી <mark>ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ</mark>ના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનાર, ધી સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ના પ૪) અને સેક્શન ૧૩(૧૨)ને ધી સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતાં હેઠળ મળેલ સત્તાની રૂએ દેણદાર ને એક ડિમાન્ડ નોટિસ્ મોકલી હતી નોટિસમાં જણાવેલ રકમ અને તેના પરનું વ્યાજ ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવેલ. દેણદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલ છે, જેથી દેણદારો અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે નીચે વર્ણવેલ મિલકતોનો નીચે સહી કરનારે તેને મળેલ સદર કાયદાના સેક્શનના સબ-સેક્શન (૪) સેક્શન ૧૩ ને ધ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની <mark>રૂએ ક્લજો</mark> લીધો છે. દેશદારને વિશેષ <mark>રૂપે</mark> અને અને જાહેર જનતાને સામાન્ય રીતે સૂચિમાં જણાવેલ મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવોમાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા ધિરાણ અને તેના પરના વ્યાજે સાથે **મેસર્સ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ** ફાઇનાન્સ કંપની <mark>લિમિટેડ</mark>ના ચાર્જમાં ગણાશે. સિક્ચોર્ડ અસ્કચામતો છોડાવવાની ઉપલબ્ધતા સમયમર્યાદા અંગે સરફેસી કાયદાના સેક્શન ૧૩ના તબ-સેક્શન (૮) તરફ દેણદારનું ધ્યાન દોરવામાં આવે છે.

પરિશિષ્ટ ૪ [લુઓ નિયમ ૮(૧)] કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

દેણદારનું નામ અને સરનામું અને લોન એકાઉન્ટ નં.	ડીમાન્ડ નોટીસની તારીખ	બાકી રકમ	કબજાવાળી મિલકતનું વર્ણન	વારીખ કબજાની						
Loan A/c Nos.XOHLMES00002095704 વિજયકુમાર રામપ્રસાદ લોઢા સેજલબેન વિજયકુમાર લોઢા રામપ્રસાદ રામસિંદ લોઢા રામપ્રસાદ રામસિંદ લોઢા ભદા રહે છે : લોઢાવાસ, મુખ્યા ડાક, ધરાજપુર-૩૮૫૫૩૫. અહીં પણ : ૧૯બી. ગુરૂ ગ્રીન સોસાયટી, ભોયણ રોડ, ડીસા, ભોયણ રોડ. ડીસા-૩૮૫૫૩૫	£502-£0-9b	રૂા. ૨૯,૦૭,૦૪૩/- (અંકે રૂપિયા ઓગણત્રીસ લાખ સાત હજાર ત્રેતાલીસ પુરા)	મિલકતનો તમામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં. ૧૯ પી, ના સર્વે નં. ૫/૧, ભોયમ સીમ, તા.ડીસા, જીલ્લો બનાસકાંઠા, જેનું ક્ષેત્રફળ ૭૮.૩૭૫ ચો.મી. પ્લોટ નં. ૧૯પી, ગુરૂ ગ્રીન સોસાયીટી, ભોયણ રોડ, તા. ડીસા, જી. બનાસકાંઠા	64-44-2023 કબજો						
Loan A/c Nos. X0HLMES00002359170 બાબુભાઈ કાલુભાઈ નાઈ ગીતાબેન બાબુભાઈ નાઈ બધા રહે છે : હરીજન વાસબુરલ, ખીંમત, બનાસકાંઠા, ડીસા -૩૮૫૫૪૫ અહીં પણ : પ્લોટ નં. ૧૨૦ ગુરૂ ગ્રીન સોસાયર્ટ ભોયણ રોડ, ડીસા, ભોયણ રોડ. ડીસા-૩૮૫૫૩૫	-0350-5	(અંકે રૂપિયા	મિલકતનો તમામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં. ૧૨૦ સર્વે નં. ૫/૧, ભોયણ સીમ, તા.ડીસા, જીલ્લો બનાસકાંઠા, જેનું ક્ષેત્રફળ ૮૬.પ૧ ચો.મી. સીમાઓ સાથે.	64-40-30 કબબે						
di. : 04-99-2023			અધિકૃત અધિકારી,							
स्थण : डीसा			સ્થળ : ડીસા મેસર્સ ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ							

TATNABHUMI DEVELOPERS LIMITED Ra**ır**na

CIN: L45200GJ2006PLC048776

Regd. Office: Ratna Corporate House, Near Santoor Bungalows, Ambli, Daskroi, Ahmedabad-380058, Gujarat, India Contact No:+91 87585 51175; | Email:cs@ratnagroup.co.in; | Website: www.ratnagroup.co.in;

EXTRACT OF UNAUD	ITED CO	NSOLI	DATED F	INANCIAL	RESULTS FOR THE
QUARTER AN	D HALF	VFAR E	INDED 3	OTH SEPTEM	IRFR. 2023

	*-		(F	Rupees in Lakhs	except EPS)
Sr. No.	Particulars	Quarter ended 30-09-2023 (Unaudited)	Quarter ended 30-09-2022 (Unaudited)	Half year ended 30-09-2023 (Unaudited)	Year Ended 31-03-2023 (Audited)
1	Total Income from Operations	22.47	6.36	33.34	21.63
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4.87	(14.89)	2.69	(21.73)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	4.87	(14.89)	2.69	(21.73)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	5.45	(14.88)	1.88	(21.08)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6.08	11.40	6.24	23.38
6	Equity Share Capital	1370.00	1370.00	1370.00	1370.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	_	-	2107.32
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) – 1. Basic: 2. Diluted:	0.04 0.04	0.08 0.08	0.05 0.05	0.17 0.17

Note: a) The above is an extract of the detailed format of Quarterly and Half yearly Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and half yearly Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange at www.bseindia.com and the company at www.ratnagroup.co.in

o) The Turnover for the Quarter ended 30th September, 2023 is ₹ 29.24 lakhs, Profit before tax is ₹ 5.53 lakhs and Profit after Tax is ₹ 6.11 lakhs on stand-alone hasis For, Ratnabhumi Developers Limited

Kaivan Shah Chairman and Managing Director DIN: 01887130



Place: Ahmedabad

Date: 09-11-2023

VADILAL CHEMICALS LIMITED

Regd. Office: 9TH Floor, Colonnade Building, Opp. Isocn Temple BRTS Bus stop, Ambli-Bopal Road, Ahmedabad-380054.,

CIN: L24231GJ1991PLC015390, EMAIL ID: info.vcl@vadilalgroup.com **EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS**

FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30-09-2023								
(Rs. In Lacs except per share data)								
Particulars	Quarter ended on 30-09-2023	Current Year cumulative upto 30-09-2023 (6 months)	Corresponding three months ended on 30-09-2022 in the previous year					
	(Unaudited)	(Unaudited)	(Unaudited)					
Total income from operations (net)	2275.54	4190.57	2107.21					
Net Profit for the Period before tax,								
Exceptional Items/ Extraordinary Items	158.20	278.55	112.63					
Net Profit for the period before tax	158.20	278.55	112.63					
Net Profit for the period after tax	118.02	207.92	81.41					
Total Comprehensive Income for the Period	115.02	204.34	79.58					
Equity Share Capital	487.40	487.40	487.40					
Earnings Per Share (of Rs. 10 each)								
Basic:	2.42	4.27	1.67					
Diluted:	2.42	4.27	1.67					

Notes:

Date: 9th November, 2023

Place: Ahmedabad

- 1) The above is an extract of the detailed format of Unaudited Financial Results of the Company for the quarter and half year ended on 30-09-2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the guarter and half year ended on 30-09-2023 are available on Company's website viz www.vadilalchemi-
- The above Unaudited Financial results have been approved by the Board of Directors at its Board Meeting held on 9th November, 2023 and Limited Review of the above results have been carried out by statutory auditor of the company.

FOR VADILAL CHEMICALS LIMITED

DEVANSHU L. GANDHI DIRECTOR

DISHMAN CARBOGEN AMCIS LIMITED

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended 30-09-2023

CIN : L74900GJ2007PLC051338 Email ID : grievance@imdcal.com Web : www.imdcal.com nman Corporate House, Iscon - Bopal Road, Ambli, Ahmedabad 380 058 Phone No: 02717- 420102/124

	(Rupees in Crores / in Ten Mil						
Sr. No.	Particulars	For The Quarter ended 30-09-2023 Unaudited	For The Preceding Quarter ended 30-06-2023 Unaudited	For The Corresponding Quarter ended 30-09-2022 Unaudited	For The Half Year ended 30-09-2023 Unaudited	For The Corresponding Half Year ended 30-09-2022 Unaudited	For The Year ended 31-03-2023 Audited
1	Total Income from operations (net)	586.59	723.38	613.96	1,309.97	1,154.57	2,412.92
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(33.21)	29.49	(12.29)	(3.72)	(12.59)	(6.44)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(36.26)	29.49	(12.29)	(6.77)	(12.59)	(54.59)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(40.90)	17.00	(10.05)	(23.90)	(6.04)	(29.80)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(96.52)	57.70	23.41	(38.82)	5.06	260.74
6	Equity Share Capital	31.36	31.36	31.36	31.36	31.36	31.36
7	Reserves (excluding revaluation reserve)	-	-	-	-	-	5,778.31
8	Securities Premium Account	-	-	-	-	-	4,738.76
9	Net worth	-	-	-	5,770.83	-	5,809.67
10	Paid up Debt Capital/ Outstanding Debt	-	-	-	1,950.60	-	1,824.51
11	Outstanding Redeemable Preference Shares	NA	NA	NA	NA	NA	NA
12	Debt Equity Ratio (Number of times)	0.34	0.34	-	0.34	-	0.31
13	Earnings Per Share (of Rs.2/- each) (for continuing and discontinued operations) -						
l	Basic	(2.61)	1.08	(0.64)	(1.52)	(0.39)	(1.90)
	Diluted	(2.61)	1.08	(0.64)	(1.52)	(0.39)	(1.90)
14	Capital Redemption Reserve	-	-	-	-	-	-
15	Debenture Redemption Reserve	-	-	-	-	-	-
16	Debt Service Coverage Ratio	2.38	2.33	-	2.38	-	2.67
17	Interest Service Coverage Ratio	4.29	4.26	-	4.29	-	5.10

- Exceptional and/ or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules/ AS Rules, whichever is applicable

For the other line items referred in regulation 52(4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulation pertinent disclosures have been made to the Stock Exchange(s) BSE Limited and National Stock Exchange of India Limited and can be accessed www.bseindia.com, and www.nseindia.com.

- ? The impact on net profit/ loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclo by means of a footnote.

 The Financial results (standalone and consolidated) have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meetings held on 8th November, 2023. These financial results (standalone and consolidated) have been prepared in compliance with Ind AS as notified by
- the Ministry of Corporate Affairs and prescribed under Section 133 of the Companies Act, 2013, read with relevant rules issued thereunder and othe accounting pronouncements generally accepted in India, to the extent applicable.

 The specified items of the standalone financial results of the company are given below;

	(
Sr. No.	Particulars	For The Quarter ended 30-09-2023	For The Preceding Quarter ended 30-06-2023	For The Corresponding Quarter ended 30-09-2022	For The Half Year ended 30-09-2023	For The Corresponding Half Year ended 30-09-2022	For The Year ended 31-03-2023	
l		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
i	Turnover	59.72	69.55	106.54	129.27	211.02	402.55	
ii	Profit/(Loss) before tax	(9.26)	(33.03)	(26.79)	(42.29)	(66.48)	(96.20)	
iii	Net Profit/(Loss) after tax	(5.78)	(21.33)	(17.28)	(27.11)	(42.11)	(58.87)	
iv	Total Comprehensive Income (After Tax)	(3.45)	(15.08)	(35.15)	(18.53)	(73.96)	(117.48)	

(Rupees in Crores / in Ten Million

The previous quarter / year figures have been re-grouped, re-cast and re-arranged wherever considered necessary to make it comparable 6 The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 202 filed with the Stock Exchanges under Regulations 33 and 52 of the SEBI (Listing and Other Disclosure Regulations, 2015 ("Listing Regulations"). The full format of the standalone and consolidated financial results for the guarter and half year ended September 30, 2023 are available of the Stock Exchanges websites www.bseindia.com, and www.nseindia.com and on the Company's website www.imdcal.com.

For and on behalf of the board

Arpit J. Vyas Global Managing Director DIN: 01540057 Place: Vitznau Date: 8th November, 2023

adani

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ Renewables

એક્સ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સભ્યોની એક્સ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટિંગ (ઇજીએમ) મંગળવાર, પમી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે, જેમાં ઇજીએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ ધરાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફર્સનાં પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને પરિપત્ર નં. ૨૧/૨૦૨૧ તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૨૧ અને SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને SEBI/HO/CFD/CMD2/CIR/P/2020/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ (પરિપત્રો) ને ધ્યાનમાં રાખતા, વ્યક્તિગત હાજરી વગર યોજાશે.

પરિપત્રોને અંતર્ગત પમી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાનાર ઇજીએમની નોટિસ, જે સભ્યોના ઇમેલ કંપની અથવા ડિપોઝીટરી પાસે નોંધાચેલ છે, તેઓને મોક્લવામાં આવેલ છે. પરિપત્રો અંતર્ગત છાપેલ નોટિસ મોકલવાની જરૂરીયાત મોક્ફ રાખવામાં છે. ઇજીએમ બોલાવવા માટેની નોટિસ, કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com તથા નેશનલ સિક્યોરિટીસ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ)ની વેબસાઇટ www.evoting.nsdl.com ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

કંપનીઝ એક્ટની ક્લમ ૧૦૮ની જોગવાઇઓ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિક્લાયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ના નિયમન ૪૪ અન્વયે, ઇજીએમની નોટિસમાં વર્ણવવામાં આવેલા તમામ ઠરાવો ઉપર સભ્યોને તેમનો મત ઇલેક્ટ્રોન્કલી આપવા માટે ઇ-વોટિંગની સુવિધા નેશનલ સિક્યોરિટી ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) મારફતે પૂરી પાડવામાં આવેલ છે. મતના અધિકારો શુક્રવાર, 3જી નવેમ્બર, ૨૦૨૩ રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્સની સંખ્યાના આદ્યારે પ્રમાણસર ગણાશે, કે જે કટ-ઓફ તારીખ છે.

જો કોઇ સભ્ય એ ઇ-મેલ નોંધણી કરાવેલ નથી, તો નીચે દર્શાવેલ સૂચના અનુસાર લોગ-ઇનની વિગતો મેળવી શકે છે.

- અ. ફિઝીક્લ શેર ધરાવતા સભ્યો માટે જરૂરી વિગતો જેમ કે ફોલિઓ નં., શેરધારકનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેલ કોપી (આગળ અને પાછળ), પાન (સ્વ. પ્રમાણિત પાનકાર્ડ ની કોપી), આધાર (સ્વ. પ્રમાણિત આધાર કાર્ડની કોપી) કંપનીના ઇ-મેલ investor.agel@adani.com ઉપર મોક્લવા.
- Demat માં શેર ધરાવતા શેર ધારકો જે-તે ડિપોઝીટ પાર્ટિસીપન્ટ પાસે ઇ-મેલ નોંધણી કરાવી શકે છે અથવા investor.agel@adani.com ઉપર DPID-client ID, નામ, Client Master, સ્વપ્રમાણિત પાન તથા આધારની કોપી મોકલાવી કરાવી શકે છે.

ડિમેટ અથવા ફિઝીક્લ શેર ધારકો પોતાનો વોટ ઇલેક્ટ્રોનીક્લ આપી શકે છે. સભ્યોને એ પણ જણાવવામાં આવે છે કે,

- નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ બિઝનેસ, ઇલેક્ટ્રોનીક વોટિંગ દ્વારા જ હાથ ધરવામાં
- રિમોટ ઇ-વોટિંગ શુક્રવાર ૧લી ડિસેમ્બર, ૨૦૨૩ના સવારે ૯:૦૦ વાગે શરૂ થશે.
- રીમોટ ઇ-વોટિંગ સોમવાર ૪થી ડિસેમ્બર, ૨૦૨૩ના સાંજે ૫:૦૦ વાગે પૂર્ણ થશે.
- જે વ્યક્તિ નોટિસ મોકલ્યા પછી સભ્ય બને છે અને કટ ઓફ્ના દિવસે શેર્સ ધરાવે છે, તેઓ evoting@nsdl.com અથવા investo.agel@adani.com ઉપર મેલ કરીને લોગ ઇન તથા પાસવર્ડ મેળવી શકે છે. અગર, જો તેઓ પહેલેથી નોંધાચેલ છે, તો હાલના લોગ ઇન અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.
- ઉપર દર્શાવેલ સમય પૂર્ણ થતા એનએસડીએલ દ્વારા વોટિંગ બંધ કરી દેવામાં આવશે અને તે બાદ સભ્યો ઇલેક્ટ્રોનીક વોટ કરી શકશે નહી.
- એફ. એક વાર Resolution પર વોટ કર્યા પછી, તેઓ હેરફાર કરી શકશે નહીં.
- જે સભ્યોએ રિમોટ-ઇ-વોટિંગ કરેલ છે, તેઓ ઇજીએમમાં હાજર રહી શકે છે, પરંતુ ઇજીએમ દરમ્યાન વોટ કરી શકશે નહીં.
- એચ. જે સભ્યોએ પહેલેથી વોટ કરેલ નથી અને ઇજીએમમાં હાજર છે, તેઓ ઇજીએમમાં ઇ-વોટિંગ દ્વારા વોટ આપી શકે છે.

ઇ-વોટિંગ માટે જો આપના કોઇ સવાલ હોય તો સભ્યો તે માટે www.evoting.nsdl.com ઉપર હેલ્થ એક્શનમાં (ફિક્વન્ટલી આસ્કડ ક્વેશ્વન્સ - FAQs) (અવારનવાર પુછાતા પ્રશ્નો) અને ઇ-વોટિંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા evoting@nsdl.co.in પર ઇ-મેઇલ કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર: ૧૮૦૦-૧૦૨૦-૯૯૦ ૫૨ ફોન કરીને જાણકારી મેળવી શકે છે. ઇ-વોટિંગને લગતી કોઇ પણ ફરિયાદ હોય તો, સરીતા મોટે, નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝટરી લિમિટેડ, ટ્રેડ વર્લ્ડ, એ-વિંગ, ચોથો માળ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાયટ માર્ગ, લોવર પરેલ (પૂર્વ), મુંબઇ - ૪૦૦૦૨૩ નો સંપર્ક ઇ-મેલઃ evoting@nsdl.co.in પર અથવા ઉપરોક્ત ટોલ ફ્રી નંબર ઉપર કરી શકાશે.

ઇજીએમને લગતી માહિતી કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com એમએસડીએલની વેબસાઇટ evoting@nsdl.com તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com તથા www.nseindia.com ઉપર પણ ઉપલબ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વતી,

પ્રફોશ દરજી

તારીખઃ ૦૯-૧૧-૨૦૨૩ **રજસ્ટર્ડ ઓફિસઃ** "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. ફોનઃ +૯૧-૭૯-૨૬૫૬ ૫૫૫૫ | ફેક્સઃ +૯૧-૭૯-૨૫૫૫ ૫૫૦૦ વેબસાઈટ: www.adanigreenenergy.com | સીઆઈએન: L40106GJ2015PLC082007

સ્થળ: અમદાવાદ